To,
The Manager
The Department of Corporate Services,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001

Dear Sir/Ma'am,

Sub: Newspaper advertisement pertaining to Audited Financial Results of Q1 FY 2022-23.

Ref.: Shanti Educational Initiatives Limited, Scrip Code: 539921, Security ID: SEIL

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended, please find enclosed copies of the newspaper advertisement pertaining to financial results of the Company for the quarter ended on June 30<sup>th</sup>, 2022. The advertisements were published in Financial Express (English) and Financial Express (Gujarati) Newspapers today.

Please take the above disclosure on record.

Thanking you.

Yours faithfully,

For Shanti Educational Initiatives Limited

Harshha Saxena Company Secretary Membership No. A45788





Shanti Educational Initiatives Limited: CIN - L80101GJ1988PLC010691

Registered Office: 1909 - 1910, D Block, West Gate, Nr. YMCA Club, S. G. Highway, Ahmedabad-380051, Gujarat

**FINANCIAL EXPRESS** 

**AAVAS FINANCIERS LIMITE ⊗** ∆cyas (Formerly known as Au HOUSING FINANCE LIMITED) (CIN:L65922RJ2011PLCO34297) Regd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Mansarovar Industrial Area, Jaipur. 302020

Demand Notice Under Section 13(2) of Securitisation Act of 2002 As the Loan Account Became NPA therefore The Authorised Officer (AO) Under section 13 (2) Of Securitisation And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act 2002 had issued 60 day demand notice to the borrower as given in the table. According to the Notice if the Borrower does not deposit the Amount within 60 days, the amount will be recovered from Auction of the security as given below. As the demand Notice send to the borrower/guarantor has not been served, copy of demand notice has also been affixed on the secured assets as given below. Therefore you the borrower is informed to deposit the loan amount along with future interest and recovery expenses within 60 days, otherwise under the provisions of section 13 (4) and 14 of the said Act, the AO is free to take possession of the Security as given below.

Name of the Borrower	Date and Amount of Der Notice Under Sec. 13(	64 (2 C C C C C C C C C C C C C C C C C C
Mrs. JAYABA NATHUBHA RAYJADA, Mr. SANJAYSINH RAYJADA, Mr. NATHUBHA RAYJADA (A/c No.) LNBHV00518-190074875 & LNBHV09820-210165546	06 Aug 2022 ₹ 541842/- & ₹ 493508/- 03 Aug 2022	PLOT NO. B-5201, SITUATED AT VADVA KNWON AS KALIYABID OF LAND REVENUE SURVEY NO:471/2-3-4 OF VILLAGE: VADVA, TALUKA AND DIST. BHAVNAGAR, GUJARAT Admeasuring 100.20 Sq. Mtrs
Mr. KISHORBHAI NANJIBHAI VARSADIYA, Mrs. KOKILABEN KISHORBHAI VARSADIA Guarantor: Mr. ALPESH THAKARSHIBHAI VAMJA (A/c No.) LNCHK00319-200124775	06 Aug 2022 ₹ 1222563/- 03 Aug 2022	RESIDENTIAL FLAT G1/301, 3RD FLOOR, GIRIRAJ RESIDENCY, SOPAN KESAR, MORAIYA, SANAND, AHMEDABAD, GUJARAT Admeasuring 115 Sq. Yard
Place : Jaipur Date : 09.08.2022		Authorised Officer Aavas Financiers Limi



CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED Corporate Office: 1st Floor, 'Dare House', No. 2, N.S.C. Bose Road, Chennai - 600001.

APPENDIX IV | See the & [1]] Pussessiun Hutice (for immovable property) neas the undersigned being the Authorized Uniter of Aris. Cholamandalam Investment and Finance Company Limited, unit Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 (54 of 2002), and in exercise of the powers conferred under Section 13 [12] read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated mentioned below under Section 13(2) of the said Act calling upon you being the borrowers (names and addresses mentioned below) to repay the amount mentioned in the said notice and interest thereon within 60 days from the date of receipt of the said notice. The Borrowers mentioned herein below having failed to repay the amount, notice is hereby given to the Borrowers mentioned herein below and to the Public in General that the undersigned has taken. Possession of the property described herein below in exercise of powers conferred on me under sub-section (d) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002. The Borrowers membraned here in above in particular and the Public in General are hereby cautioned not to deal with said Property and any dealings with the Property will be subject to the charge of M/s. Cholamandalam Investment and Finance Company Limited for an amount as mentioned herein under and interest thereon. The

borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act. In respect of time available, to redeem the secured assets.

Sr. No.		Demend Notice	Outstanding Amount	Description of the Property Possessed	Date of Possession
1.	Loan A/c No. HL01 A JR000004642 1) Nalsargi Mayankkumar Oza 2) Mayankkumar Oza Both Residing At: Flat No. D/40. Nr Golbar. Hanuman Bhavnagar. Gujarat- 364002 AND Sadguru Ashram. Madhapar Chowlidi. Rajkot-360007.	88	₹ 26 A5 987.20/- (Rupees Twenty Six Lakhs Foily Five Thousand Nine Hundled Eighty Seven and Twenty Pase)	[ Tig. for Sq. Mrt., Situated dil Fullitil Fludi di Dulia-	05/03/2022 (Symbolic Possession)
2.	Loan A/c No. XVHLA ME00002485493 1) Parth Rajeshbhal Joshi 2) Rajesh Mahendrabhal Joshi 3) Bhavnaben Rajendrabhal Joshi Residing At: A-101, Syamshikhar Residency, Opp-HP Petrol Pump, Naroda, Ahmedabad Gujarat - 382330 AND A-401, 4º Floor, Shyam Shikar Residhecey, Opp. HP Petrol Pump, Geb Naroda, Ahmedabad - 382346	8	© 21 /42 /423 986/-  Rupees Twenty One Lakts Forty Two Thousand Four Hundred Twenty Three and Ninety Nine Parse)	Rat No. A/401 on 4* Floor, Block No. A. "Shyam Sikhar Residency" Situated Revenue Servey Number 544/1, TPS No. 121, FP No. 19, Mouje - Naroda, Taluka - Asama, Dist & Sub Dist - Ahmedabad  Admeasuring about 107,86 Sq. Mth Bounderies : East - Stair Passage & Plat No. A/404, West - FP No. 20 & Amrdeep Apartment, North - Flat No. A/402, South - Block No. I.	04/08/2022 (Symbolic Possession)



Date : 05.08.2022

Ahmedabad Regional Office:

4th floor, Sakar VII, Nehru Bridge Junction, Ashram Road, Navrangpura, Ahmedabad, Gujarat - 380 009. Email: ro1018@sib.co.in , Phone: 079 - 2658 5600, 5700, 1600

Authorised Officer

WHEREAS the Authorised Officer of the Bank (hereinafter referred as AO) had issued Demand Notice dated 05.09.2019 and its Pape ublication in Business Standard and Sandesh on 29.11.2019 to borrower /Gurantors : 1)M/s Gujarat RMC Infra and Projects through its Partners, Shop No: 8/F/F, 236, Urvi Complex, B/h Bungalow Bus Stand, NH 8, Naroda, Ahmedabad, Gujara in 382 330, **Also at:** Chharodi Gam, Nr. SG Highway, Ahmedabad. **2) Mr. Dharmendra Sinh Bhati,** Partner of M/s Gujara RMC Infra and Projects, C-5, Vasudev Park, Near Parshwanath Township, New Naroda, Ahrnedabad, Gujarat. Pin 382 330. 3) Mr. Pragnesh Dilipbhai Patel, Partner of M/s Gujarat RMC Infra and Projects. B-3, Sangita Society, Gayatri Mandi toad, Ranip, Ahmedabad Gujarat, Pin 382 480. 4) Mr. Narendra Sinh Bhagwansinh Sisodiya , Partner of M/s Gujarat RMC Infra and Projects, 41, Urja Nagar Housing Society 3, Charedi Pethapur, Gandhinagar, Gujarat Pin 382 610. 5) Mr. Dhaval Satishkumar Chudasma, Partner of M/s Gujarat RMC Infra and Projects, 21-8, Tulsi Shyam, Tulsi Part Society, Bhimilipur Cross Road, Nava Vadaj 55 Ahmedabad, Gujarat Pin 380 013. 6) Mr. Kuldip Sinh Jagat Sinh Parmar Partner of M/s Gujarat RMC Infra and Projects. B-3, Sangita Society, Gayatri Mandir, Road Ranip, Ahmedabad, Gujarat Pin 382 480. 7) Mr. Bhagvansinh Ratansinh Sisodiya, Darbar Fall, Moti Bebar, TA: Bhiloda Dist Arvalli, Gujarat Pin 383 250. Smt. Vishnakunvar Bhagvansinh Sisodiya, 11, Darbar Fail, Moti Bebar, TA: Bhiloda Dist: Arvalli, Gujarat Pin 383, 250, 9) Mrs. Minal Dhavalsinh Chudasma, 21-8, Tulsi Shyam, Tulsi Park Society, Bhimjipur Cross Road, Nava Vadaj 55, Ahmedabad Gujarat Pin 380 013, under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes

TENDER CUM AUCTION SALE NOTICE

AND WHEREAS, the borrower/guarantor have failed to pay the amount in full, Notice is hereby given that the immovable property more ully described in the Schedule hereunder will be sold by way of tender cum auction on "as is where is" basis and "as is what is' condition, on the date and at the place mentioned herein below for realization of a sum of Rs. 1,45,61,251.89 (Rupees One Crore forty five lakhs sixty one thousand two hundred fifty one and paise eighty nine) as on 23-08-2021 with further interes

Act, 2002 (hereinafter referred to as 'The Act') and has taken **possession** of the immovable property, more fully described in the schedule ereunder under Section 13(4) of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 27-02-2020

and costs, subject to	the following terms and conditions: -
Name of Property Owners	Mr. Bhagvansinh Ratansinh Sisodiya & Smt. Vishnakunvar Bhagvansinh Sisodiya
Description of properties	All that piece and parcel of land measuring 112 Sq Meters with building bearing No. Revenue Survey No. 355/ A-41 of Panchayat/ Municipality/ Corporation bearing Survey No. 355/A-41 in Pethapur Village, Gandhinagar Taluk District, more fully mentioned in Sale Deed No. 9006/2004 dated 28.09.2004 of SRO Gandhinagar and bounded on the: North: Common Plot, South: Plot No. 40, East: Plot No. 16, West: Public Road Situated within the Registration Sub District of Gandhinagar and Registration District of Gandhinagar
Reserve Price	Rs.55,51,000/- (Rupees Fifty five Lakhs fifty one thousand Only)
Earnest Money Deposit (EMD)	Rs.5,55,100l- (Rupees Five lakhs fifty five thousand one hundred Only) shall be paid on or before 21-09-2022 before 4.00 pm by way of DD drawn in favour of "The Authorised Officer, The South Indian Bank Ltd." payable at Ahmedabad or through RTGS/NEFT to Account No 0179073000010463 held by 'The Authorised Officer' in The South Indian Bank Ltd. Ahmedabad branch (IFSC: SIBLO000179).
Date and Place of Sale	22-09-2022 at 2.00 pm at The South Indian Bank Ltd, Aakar Arcade And Residency, Shop No. 1 To 4, Hilon Business Centre, Near Harivallabh Society, Naroda, Ahmedabad, Gujarat 382330., Contact: Contact No: 079 22810838 during working hours or may contact Mr.Darshan S B, Manager - Quality Circle Contact No: 26585600700, 9620704416

For detailed terms and conditions of the sale, please refer to the link provided in South Indian Bank Ltd. website i.e. www. southindianbank.com **AUTHORISED OFFICER** 

Date: 08.08.2022, Place: Ahmedabad (CHIEF MANAGER)

# SHANTI EDUCATIONAL INITIATIVES LIMITED



Reg. Office: 1909 - 1910, D Block, West Gate, Nr. YMCA Club, S. G. Highway, Ahmedabad, Gujarat-380015 CIN: L80101GJ1988PLC010691 Contact No. +079 66177266, +91 9099004846 Email: info@seil.edu.in, website: www.sei.edu.in

			(Rs.	in lakhs ex	cept EPS	
Sr	Particulars	- 1	luarter Ende	d	Year Ended	
No		30.06.2022	31.06.2021	31.03.2022	31.03.2022	
,		Unau ditted	Audited	Unaudited	Audited	
1.	Total Income from Operations (net)	459.08	108.79	394.48	747.66	
2.	Net Profit for the period (before tax,					
	exceptional and / or extraordinary items)	177.71	-12.40	135.43	79.74	
3.	Net Profit for the period before tax (after					
~	exceptional and / or extraordinary items)	177.71	-12.40	135.43	79.74	
4.	Net Profit for the period after tax (after		*			
	exceptional and / or extraordinary items)	132.98	-12.40	136.71	79.88	
5.	Total Comprehensive Income for the period	î			2.	
	[comprising Profit for the period (after tax)					
	and Other Comprehensive Income (after tax)]	132.98	-12.40	146.85	90.02	
6.	Equity Shares Capital	Service Co.		21.25.02.92		
	(Face value of Rs. 10/- each)	1610	1610	1610	1610	
7.	Reserve (excluding revaluation Reserve) as	î î			7-	
	shown in the Audited balance sheet of the					
	previous year	, ×	40		4093	
8.	Earnings per share					
В	(for continuing and discontinued operations)					
3	Basic	0.01	(80.0)	0.85	0.50	
	Diluted	0.01	(80.0)	0.85	0.50	

## NOTES:

- The above Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 08.08.2022.
- 2. This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standard) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013, and rule made there under (Indian Accounting Standard) Rules, 2015 and Companies (Indian Accounting Standard) Accounting Rules, 2016.
- Figures for the previous periods / year have been regrouped, recast, and rearranged, wherever necessary.
- The Company has only one segment of activity, namely Education.
- 5. The Full audited Financial Result available on the website of the company as www.seil.edu.in and on the Website of the Stock Exchange Limited www.bseindia.com For, Shanti Educational Initiatives Limited

Darshan Vayeda

Place: Ahmedabad Whole-time Director DIN: 07788073 Date: 08.08.2022





POSSESSION NOTICE

Whereas, the undersigned being the Authorized Officer of the AXIS BANK LTD, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a demand notice dated mentioned herein below tabel calling upon the Borrower/Co-Borrower/Mortgagor/Guarantor, mentioned herein below table to repay the amount mentioned hereunder in the notice as mentioned in the said notice together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, costs, charges etc. incurred / to be incurred, within 60 days from the date of the said notice. Borrower/Co-Borrower/Mortgagor/Guarantor, mentioned herein below tabel having failed to repay the Bank's dues as mentioned in the notice issued to him under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, notice is hereby given to the Borrower and other mentioned herein above in particular and the public, in general, that the undersigned has taken Possession (mentioned herein below tabel) of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said Rules on following date.

Borrower/Co-Borrower/Mortgagor/Guarantor mentioned herein below tabel in particular, and the public, in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the AXIS BANK LTD for an amount mentioned herein below tabel as mentioned in the said notice together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, costs, charges etc. incurred / to be incurred. The Borrower's attention is invited to the provisions of sub Section (8) of section 13 of the SARFAESI act, 2002 in respect of time available, to redeem the secured assets

			DESCRIPTION OF THE PROPERTIES	A. a. a. a.
Sr. No.	Name of Borrowers / Guarantors / Co-Borrower	Demand Notice Date & O/s, Amount Rs. (interest + Charges - Recovery	SCHEDULE OF IMMOVABLE PROPERTY	Date & Type of Possession
1.	(1) Mr. RAMESHBHAI RATANBHAI MAHESHVARI (2) Mrs. LILABEN RAMESHBHAI MAHESHWARI	27-09-2019 / Rs.714620/- as on 21-09-2019	ALL THE PIECE AND PARCEL OF FLAT. NO. A-103, WING NO - A., ON FIRST FLOOR IN RESIDENTIAL SCHEME KNOWN AS "NILKANTH VALLY" HAVING BUILT UP AREA OF FLAT ADM 54.77 SQ MTR, ON N. A LAND REVENUE SURVEY NO - 140, ON NA PLOT NO - 0/19, D/20, D/21, AND D/22, LYING AND BEING AT MOUJE VILLAGE GHANTESHWAR, TALUKA RAJKOT, REGISTRATION SUB DISTRICT AND REGISTARTION DISTRICT RAJKOT. THE SAID PROPERTY IS BOUNDED AS FOLLOW: SURROUNDING - NORTH: FLAT NO A-102, OTS., SOUTH: MARJIN SPACE, EAST: OPEN TO SKY, WEST: STTAIRS, PASSAGE, OTS	07-08-2022 PHYSICAL
2.	(1) SANGANI ANILBHAI DHIRUBHAI (2) SAGAR DHIRAJBHAI SANGANI	20-04-2021 / Rs.827389/- as on 17-04-2021	ALL THE PIECE AND PARCEL OF FLAT NO. 401 ON FOURTH FLOOR OF WING - J IN RESIDENTIAL SCHEME KNOWN AS "AVKAR CITY" HAVING BUILT UP AREA ADM. 29-62 SQ. MTR. ON NA LAND BEARING REVENUE SURVEY NO. 10 PAIKI 2, LYING AND BEING AT MOUJE VILLAGE - VAVDI, REGISTRATION SUB DISTRICT & REGISTRATION DISTRICT - RAJKOT. THE SAID PROPERTY IS BOUNDED AS FOLLOW: SURROUNDING: - NORTH: OPEN TO SKY, SOUTH: COMMON PASSAGE, EAST: OPEN TO SKY, WEST: FLAT NO. 406	07-08-2022 PHYSICAL

referred to in this Notice without prior written consent of our Bank. Date: 08-08-2022, Place: Gujarat Authorised Officer, Axis Bank Ltd













# 9th August 2022 World Tribal Day

Greetings to more than 92 lakh tribals residing in 14 districts of Gujarat on International Day of the World's Indigenous Peoples 2022

ուսիսի իրիվում իր արևի արում իր իր իրկանականակա

# Tribals in Gujarat are now partners in development

Inauguration and Laying Foundation of works worth more than ₹ 1600 crores and disbursement of assistance amounting to more than ₹ 250 crores under various individual schemes

Under Van Bandhu Kalyan Yojana, developmental works worth more than ₹1 Lakh Crore have been performed during last 15 years.

One lakh crore Rupees Planned under Van Bandhu Kalyan Yojana-2.

Scholarships of ₹ 600 Crore Rupees given to Tribal Students every year.

Uniform assistance from ₹ 600 to ₹ 900 for 13 Lakh Tribal Students and allocation of ₹81 Crore.

Through Adarsh Niwasi Schools, Eklavya Model Residential Schools, Girls Literacy Residential Schools and Ashram Schools, every year more than 1,30,000 Tribal Students are getting free meals, accommodation and quality education, with allocation of more than ₹600 Crore.

65,000 Tribal Students are getting higher education with boarding facility through 1105 Government Hostels, Grant in Aid Hostels and Samaras Hostels at a cost of ₹ 200 Crore every year.

About 1,43,000 students of Grant in Aid Hostels and Ashram Schools benefited from significant increase in maintenance grants.

Renovation of Ashram Schools in Tribal areas has been undertaken at a cost of ₹ 200 Crore.

11 Lakh Tribal students benefited from Dudh Sanjeevani Yojana at a cost of ₹ 147 Crore per year.

Birsa Munda Tribal University under construction with advanced facilities at a budget of ₹ 341 Crore on 39 Acres of land at Rajpipla.

Development works in Tribal areas under Border Village Scheme, New Gujarat Pattern, Basic facilities for Halpati caste and Adim Juth basic facilities at a cost of approximately ₹ 600 Crore per year.

A National Museum of Tribal Freedom Fighters under construction at a cost of ₹ 137 Crore in Narmada district of the State in memory of Tribal Freedom Fighters.

500 Tribal villages will get mobile network facility at a cost of ₹ 111 Crore.

Provision of ₹ 40 Crore to create 8 MSME GIDC to generate employment opportunities in Tribal Areas.

Provision of ₹38 Crore for Power Tiller assistance to Tribal Farmer beneficiaries.

Provision of ₹ 40 Crore for providing share capital loans to Tribal Area Sugar Societies.

Provision of ₹ 75 Crore for new well with Solar Pump Assistance to Tribal Farmer beneficiaries.

"I envision that every tribal family should be prosperous, educated, healthy and financially stable."

Shri Narendra Modi, Prime Minister

Date: 9th August, Tuesday l Time: 10:30 AM Place: Near Science College Jhalod-Melania, Ta. Jhalod, Dist. Dahod

**Department of Tribal Development** 

ունանարի հիմանական արանականության և Արանանայանի արևանական արևանական արևանականության և համականականության և Արանականական և Արանական և Արանականական և Արանականական և Արանականական և Արանականական և Արանական և Արանական











TAMIL NADU STATE TRANSPORT CORPORATION(CBE) LTD, 37, METTUPALAYAM ROAD: COIMBATORE-641 043.

**TENDER NOTICE NO: 01/2022-23** 

Sealed Tenders with two cover system are invited in the prescribed format for the supply of Leyland and Tata vehicle spares, Hard ware Spares, Radiator Coolant and Paint raw materials from the eligible tenderers.

The tender schedules containing EMD, specifications, terms and conditions can be obtained in person from 'M/s. TNSTC(CBE) Ltd., 37, Mettupalayam Road, Coimbatore-641 043 upto 07.09.2022 - 12.00 Noon on payment of Rs.500/- and Rs.100/- extra for Speed Post/Courier. The last day of submission of Tender 07.09.2022 - 2.00PM.

The tender forms can also be downloaded at free of cost from www.tenders.tn.gov.in.

DIPR/3690/Tender/2022 MANAGING DIRECTOR "சோதனை கடந்து சுதந்திரம் அடைந்தோம், சாதனை புரிந்து சரித்திரம் படைப்போம்."

#### SHANTI EDUCATIONAL INITIATIVES LIMITED

/Shanti Educationa SEIL Initiative Initiatives

Reg. Office: 1909 - 1910, D Block, West Gate, Nr. YMCA Club, S. G. Highway, Ahmedabad, Gujarat-380015 CIN: L80101GJ1988PLC010691 Contact No. +079 66177266, +91 9099004846

Email: info@seil.edu.in, website: www.sei.edu.in AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30™ JUNE 2022

			(Rs.	in lakhs ex	ccept EPS)
Sr	Particulars	Quarter Ended Year End			Year Ended
No		30.06.2022	31.06.2021	31.03.2022	31.03.2022
		Unaudited	Audited	Unaudited	Audited
1.	Total Income from Operations (net)	459.08	108.79	394.48	747.66
2.	Net Profit for the period (before tax,				
	exceptional and / or extraordinary items)	177.71	-12.40	135.43	79.74
3.	Net Profit for the period before tax (after				
	exceptional and / or extraordinary items)	177.71	-12.40	135.43	79.74
4.	Net Profit for the period after tax (after				
	exceptional and / or extraordinary items)	132.98	-12.40	136.71	79.88
5.	Total Comprehensive Income for the period				
	[comprising Profit for the period (after tax)				
	and Other Comprehensive Income (after tax)]	132.98	-12.40	146.85	90.02
6.	Equity Shares Capital				
	(Face value of Rs. 10/- each)	1610	1610	1610	1610
7.	Reserve (excluding revaluation Reserve) as				
	shown in the Audited balance sheet of the				
	previous year	-	-	-	4093
8.	Earnings per share				
	(for continuing and discontinued operations)				
	Basic	0.01	(0.08)	0.85	0.50
	Diluted	0.01	(0.08)	0.85	0.50
NC	OTES:				

- 1. The above Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 08.08.2022.
- This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standard) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013, and rule made there under (Indian Accounting Standard) Rules. 2015 and Companies (Indian Accounting Standard) Accounting Rules, 2016.
- 3. Figures for the previous periods / year have been regrouped, recast, and rearranged wherever necessary.
- 4. The Company has only one segment of activity, namely Education.
- 5. The Full audited Financial Result available on the website of the company as www.seil.edu.in and on the Website of the Stock Exchange Limited www.bseindia.com

For, Shanti Educational Initiatives Limited

Place: Ahmedabad

Sd/ Darshan Vayeda Whole-time Director DIN: 07788073



Date: 08.08.2022

CIN: L31200GJ2004PLC044068 Website: www.torrentpower.com E-mail: cs@torrentpower.com

#### **Torrent Power Limited**

Registered Office: "Samanvay", 600, Tapovan, Ambawadi, Ahmedabad - 380 015, Ph.: 079-26628000

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022

(₹ in Crore except per share data)

Year ended	Quarter ended
31.03.2022	30.06.2021
l Audited	Un-audited
14,257.61	3,098.91
1,863.97	272.93
563.97	272.93
458.70	207.78
455.83	207.66
480.62	480.62
9,462.56 (as at 31.03.2022)	
9.45	4.30
9.45	4.30
_	9.45

#### EXTRACT OF THE STATEMENT OF STANDALONE FINANCIAL RESULTS

Extract of the Smithwest of	JAN DALLOND		(₹ in Crore)
Particulars	Quarter ended	Year ended	Quarter ended
	30.06.2022	31.03.2022	30.06.2021
	Un-audited	Audited	Un-audited
Total income from operations	4,651.15	13,715.74	2,998.93
Net profit for the period before tax and exceptional items	639.99	1,814.38	257.52
Net profit / (loss) for the period before tax and after exceptional items	639.99	514.38	257.52
Net profit / (loss) for the period after tax and exceptional items	480.77	409.71	199.01
Total comprehensive income for the period (after tax)	481.95	411.68	199.90

1. The above is an extract of the detailed financial results for the quarter ended June 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same, along with the notes, are available on the websites of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.torrentpower.com.

Place: Ahmedabad Date: August 08, 2022

#### SINTEX PLASTICS TECHNOLOGY LIMITED

REGD. OFFICE: In the premises of Sintex-BAPL Ltd., Near Seven Garnala, Kalol (N.G.)—382 /21
Web Site: www.sintexplastics.com, E-Mail: info@sintex-plastics.com • CIN: L74120GJ2015PLC084071 Tel. No. (02764) – 253500, 6358855979

Sr. No.		Quarter ended 30/06/2022 (Un-Audited)	Quarter ended 30/06/2021	31/03/2022
(A)	Extract Of Consolidated Financial Results		(Un-Audited)	(Audited)
1.	Total income from operations (Net)	272.25	174.95	935.13
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(32.67)	(39.71)	(424.40)
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(32.67)	(39.71)	(424.40)
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(34.10)	(39.94)	(427.86)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(26.13)	(37.07)	(440.14)
6.	Equity Share Capital	63.62	63.62	63.62
7.	Reserves(excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet	-	-	(10.62)
8.	Earnings Per Share (of Re. 1/- each) (for continuing and discontinued operations)  1. Basic: 2. Diluted:	(0.54) (0.53)	(0.63) (0.62)	(6.73) (6.67)
(B)	Key numbers of Standalone Financial Results			
a.	Total income from operations (Net)	1.14	0.00	0.96
b.	Net Profit/(Loss) Before Tax	(3.54)	(3.81)	(144.22)
C.	Net Profit/(Loss) After Tax	(3.54)	(3.81)	(144.18)
B1-4-	and The Oten delege and Occasible to dillo. And the differential Descriptions and considering the first	A III A III		Decad of Discotors

Notes: 1. The Standalone and Consolidated Un-Audited Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on August 8, 2022.

Previous period's figures have been regrouped/rearmanged wherever necessary.

Above is an extract of the detailed/full format of Un-Audited Financial Results (Standalone & Consolidated) for the First Quarter ended on 30th June, 2022 filed with the Stock Exchanges under Reg. 33 of the SEBI (LODR) Regulations, 2015. Full format of the said Un-Audited Quarterly Financial Results are available on the websites of BSE & NSE at www.bseindia.com\* & www.nseindia.com\* respectively and also not Company's website at www.sintexplastics.com.

4. # Exceptional and/or Extraordinary items adjusted in the Statement of P&L Account in accordance with Ind AS Rules.

For SINTEX PLASTICS TECHNOLOGY LIMITED AMIT D. PATEL, CHAIRMAN & MANAGING DIRECTOR

#### 

#### **EXTRACT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS** FOR THE 1ST QUARTER ENDED JUNE 30, 2022

(₹ in Lakhs)

Sr. No	PARTICULARS	I CHARTER ENDED I		YEAR ENDED
		30/06/2022	30/06/2021	31/03/2022
		(Un-Audited)	(Un-Audited)	(Audited)
1	Total Income from Operations (net)	1677.43	919.52	5837.04
2	Net Profit / (Loss) for the period (before Tax - Exceptional and/or Extraordinary items)	9.90	28.70	58.37
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	9.90	28.70	58.37
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	7.29	19.13	40.91
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	7.29	19.13	40.91
6	Equity Share Capital	150.00	150.00	150.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			2366.17
8	Earnings Per Share (of Rs. 10/-each) (for continuing and discontinued operations)			
	1. Basic	0.49	1.28	2.73
	2. Diluted	0.49	1.28	2.73

Note: 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the 1st quarter ended 30th June, 2022, filed with the Stock Exchange i.e. BSE Ltd. under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results are available on the website of the Stock Exchange(s). BSE www.bseindia.com and the Company's website: www.betexindia.com

Place: Surat Date : 08/08/2022 For, BETEX INDIA LIMITED Sd/- Manish Somani Director

CIN: L17119GJ1992PLC018073 436, GIDC, Pandesara, Surat-394221, Gujarat, INDIA. 595. FAX : (91-261) 2334189, E-mail : corporate@betexindia.com



CIN: L24230GJ1972PLC002126 વેબસાઈટ: www.torrentpharma.com ย์भัยด: investorservices@torrentpharma.com

## ટોરેન્ટ ફાર્માસ્થુટિકલ્સ લિમિટેડ

૨૪૯૨૮ર્ડ ઓફ્સઃ ટોરેન્ટ હાઉસ, ઓફ આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯, ગુજરાત, ઇન્ડિયા ફોન: + ૯૧ ૭૯ ૨૬૫૯૯૦૦૦ <del>\$</del>5्सः + ८१ ७८ २६५८२१००

### सભ्योने नोटीस

સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે , કંપનીઝ એક્ટ , ૨૦૧૩ની કલમ ૧૦૮ અને ૧૧૦ તેમજ અન્ય જોગવાઈઓ જો કોઈ લાગુ પડતી હોય તો એને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂત્સ, ૨૦૧૪ અને તેમાં કોઈ સ્ટેસ્યુટરી સુધારા અથવા તો રી-ટ્સ કરાચા હોય એ સહિતનાને સાથે વંચાણે લીધા મુજબ તેમજ ઈલેકટ્રોનિક વોટિંગ (ઈ--બેલેટના સંચાલન માટે કોર્પોરેટ અફર્સ મંત્રાલય દ્વારા તારીખ ૮મી એપ્રિલ , ૨૦૨૦ , ૧૩મી એપ્રિલ , ૨૦૨૦ અને ૫મી મે , ૨૦૨૨ના રોજના સામાન્ય પરિપત્રો અનુક્રમે નં. ૧૪/૨૦૨૦ , ૧૭/૨૦૨૦ અને ૩/૨૦૨૨ (એમસીએના પરિપત્રો) અન્વયે નિયત કરાયેલી માર્ગદર્શિકાઓને અનુરૂપ તેમજ રોળી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ ૨૦૧૫ "લિસ્ટીંગ રેગ્યુલેશન્સ") નાં નિયમન ૪૪ મુજબ તેમજ અન્ય કોઈ કાયદા અને નિયમનો લાગુ પડતા હોય તો તે અન્વયે કંપનીએ **સોમવાર, ૮મી ઓગસ્ટ, ૨૦૨૨**ના રોજ વિવરણાત્મક નિવેદન સાથે પોસ્ટલ બેલેટ નોટીસ ઈલેક્ટ્રોનિક મોડથી પોસ્ટલ બેલેટ નોટીસમાં નિર્દિષ્ટ કર્ચા મુજબના ઠરાવ ઉપર સભ્યોની સંમતિ મેળવવા માટે જે સભ્યોના ઈમેઈલ એડ્રેસીઝ કંપનીન ૨જીસ્ટ્રા૨ અને ટ્રાન્સફ૨ એઁ૧ન્ટ, કેફિન ટેકનોલોજીઝ લિ.,("આ૨ટીએ")/ડીપોઝીટ૨ીઝ સમક્ષ **શુક્રવા૨, ૨૯મી જુલાઇ, ૨૦૨૨** ("**કર-ઓફ ડેર**") ના રોજ નોંધાચેલા હોય તેમને મોક્લી આપ્યા છે.

એમસીએના પરિપત્રોની શરતોનું અનુપાલન કરતાં , પોસ્ટલ બેલેટ નોટીસની ફિઝિકલ કોપી તેમજ પોસ્ટલ બેલેટ ફોર્મ્સ અને પ્રિ-પેઈડ બિઝનેસ એન્વેલોપ પોસ્ટલ બેલેટ માટે સભ્યોને મોકલવામાં આવશે નહીં અને તદ્દનસાર સભ્યોએ પોતાની સંમતિ કે અસંમતિની જાણ નીચે દર્શાવ્યા મુજબના સમયગાળામાં સેન્ટ્રલ ડીપોઝિટરી સર્વિસીઝ લિમિટેડ (સીડીએસએલ) દ્વારા પુરી પાડવામાં આવતી ઈ-વોટિંગ સર્વિસોંઝના માધ્યમથી કરવાની રહેશે.

ઈ-વોટિંગનો આરંભઃ	બુધવાર, ૧૦મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ ક્લાકે (IST)
ઈ-વોટિંગ પુરૂં થવાનો સમયઃ	ગુરૂવાર, ૮મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ કલાકે (IST)

સીડીએસએલ દ્વારા ત્યારબાદ ઈ-વોટિંગ બ્લોક કરી દેવાશે અને સભ્યોને ઉક્ત તારીખ અને સમય પછી વોટિંગ કરવ દેવાશે નહીં. કંપનીના સભ્યોના રજાસ્ટરમાં કટ-ઓફ ડેટના રોજ કંપનીની ભરપાઇ થયેલી ઇક્વિટી શેરમ્ડીમાં સભ્યો જેટલા શેર ધરાવતા હશે તેના પ્રમાણસર જ તેમના વોટિંગના અધિકાર રહેશે. કટ-ઓફ ડેટના રોજની સ્થિતિ મુજબ જે સભ્યો ફિઝિકલ મોડમાં કે ડીમેટ મોડમાં શેર્સ ધરાવતા હશે તેમને જ ઈ-વોટિંગની સુવિધાનો અધિકાર રહેશે. કટ-ઓફ ડેટના રોજ . કોઈ વ્યક્તિ સભ્ય ના હોય તો એવી વ્યક્તિએ આ નોટીસ ફક્ત માહિતીના હેંતુસરની જ ગણી લેવાની રહેશે.

### ઈ-વોટિંગ માટેની વિસ્તૃત સૂચનાઓ પોસ્ટલ બેલેટ નોટીસમાં પુરી પાડવામાં આવી છે.

પોસ્ટલ બેલેટની નોટીસ કંપનીની વેબસાઈટ <u>www.torrentpharma.com</u>, સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> તથા સીડીએસએલની વેબસાઈટ <u>www.evotingindia.com</u>

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કાયદા અનુસાર તેમજ યોગ્ય અને પારદર્શક રીતે પોસ્ટલ બેલેટની કામગીરી ઈ-વોટિંગની પ્રોસેસ દ્વારા હાથ ધરવા માટે સ્કૂટીનાઈઝર તરીકે પ્રેકટિસિંગ કંપની સેક્રેટરી રાજેશ પારેખ, પાર્ટનર આરપીએપી એન્ડ કં.ની અને વૈકલ્પિક સ્ક્રુટીનાઈઝર તરીકે પ્રેકટિસિંગ કંપની સેક્રેટરી જિતેશ પટેલ , પ્રોપ્રાઈટર જિતેશ પટેલ એન્ડ એસોસિએટ્સની નિમણુંક કરી છે.

ફિઝિકલ સ્વરૂપે શેર ધરાવતા સભ્યો અથવા તો જે સભ્યોએ પોતાના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર કરાવ્યા નથી તેઓ કેવી રીતે ઇ-वोटिंग द्वारा पोताना वोट आपी शક्शे तेनी विगतो अने ९ सल्योओ पोताना छमेछल ओड्रेस इंपनी समक्ष रજस्टर કરાવ્યા નથી તેઓ એ કેવી રીતે કરાવી શકે છે તેની વિગતો પોસ્ટલ બેલેટ નોટીસમાં આપવામાં આવી છે.

પોસ્ટલ બેલેટનું પરિણામ **સોમવાર, ૧૨મી સપ્ટેંબર, ૨૦૨૨**ના રોજ કે તે પહેલા કંપનીની રજસ્ટર્ડ ઓફિસ ખાતે જાહેર કરાશે. કંપનીની રજીસ્ટર્ડ ઓફિંસ ખાતે તે ઉપલબ્ધ કરાશે અને કંપનીની સીક્યુરીટીઝ જ્યાં લિસ્ટેડ છે તે સ્ટોક એક્સચેન્જીસને તેની જાણ કરાશે તેમજ કંપનીની વેબસાઈટ <u>www.torrentpharma.com</u>, ઉપર સ્ક્રુટીનાઈઝરના રીપોર્ટસાથે પરિણામ ઉપલબ્ધ કરાશે.

ઈ-વોટિંગ અંગે કોઈપણ પૂછપરછ અને / અથવા ફરિયાદ માટે તમે સીડીએસએલની વેબસાઈટ www.evotingindia.com ઉપેર દેવ્ય સેક્શનમાં ફ્રીક્વન્ટલી આશ્કડ ક્વેશ્વન્સ (FAQs) અને ઇ-વોટિંગ મેન્ય્અલ રીફર કરી શકો છો અથવા તો શ્રી રાકેશ દલવી, સીનીયર મેનેજર, સીડીએસએલ, એ વિંગ, રપમો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ્સ કમ્પાઉન્ડ્સ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૧૩ નો સંપર્ક કરી શકો છો અથવા તદ્ઉપરાંત <u>helpdesk.evoting@cdslindia.com</u> ને ઈમેઈલ કરી શકો છો અથવા તો ટોલ ફ્રી નં ૧૮૦૦૨૨૫૫૩૩ ઉપર કામકાજના તમામ દિવસોએ કામકાજના સમય દરમિયાન ફોન કરી શકો છો .

ડીમેટ સ્વરૂપે સીક્યુરીટીઝ ધરાવતા સભ્યોને ડીપોઝિટરીના એટલે કે સીડીએસએલ તથા એનએસડીએલના માધ્યમથી שו לשיש אינייבון בויכן אבושיבים אבואין פוא שו אין אואשי בישוקאבי

લોગિનનો પ્રકાર	હેલ્પડેસ્કની વિગતો
<b>સીડીએસએલ</b> માં ડીમેટ સ્વરૂપે સીક્યુરીટીઝ ધરાવતા વ્યક્તિગત સભ્યો	લોગિન કરવામાં સભ્યોને કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો એ માટે તેઓ helpdesk.evoting@cdslindia.com ને વિનંતી મોકલી શકે છે અથવા તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ ઉપર સંપર્ક કરી શકે છે.
<b>એનએસડીએલ</b> માં ડીમેટ સ્વરૂપે સીક્યુરીટીઝ ધરાવતા વ્યક્તિગત સભ્યો	લોગિન કરવામાં સભ્યોને કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો એ માટે તેઓ <u>evoting@nsdl.co.in</u> ને વિનંતી મોક્લી અથવા તો ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ તથા ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ ઉપ૨ ફોન કરી એનએસડીએલ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે.

ક્લળ: અમદાવાદ

તારીખઃ ૮મી, ઓગસ્ટ ૨૦૨૨

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના આદેશથી ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ વતી थिंतन त्रिवेही

કંપની સેક્રેટરી

# Super Crop Safe Limited

CIN: L24231GJ1987PLC009392 Regd. Office: C-1/290, GIDC Estate, Phase I, Naroda, Ahmedabad-382330

Phone: 079-22823907, Email: super\_crop\_safe@yahoo.com, Website: www.supercropsafe.com

#### **NOTICE** Meeting of the board of directors of the company will be held

- on Saturday, 13th August, 2022, at the registered office of the Company at 3:00 p.m. to consider the following items; 1.To consider Un – Audited Financial Result for the First Quarter Ended on 30<sup>th</sup> June 2022 as per Regulation 33 of the SEBI (Listing
- Obligation and Disclouser Requirement) Regulation 2015 2. To fix the date of Annual General Meeting.
- 3. To finalize the Director's Report & Draft of Notice for convening
- ensuing Annual General Meeting. 4. Any Other matter with the permission of the chair.

Intimation in this regard is also available on the website of the Company i.e. www.supercropsafe.com and on the website of stock exchange i.e. www.bseindia.com

For, Super Crop Safe Ltd Sd /- Hiral Patel Date: 6th August 2022 Company Secretary

Extract of Unaudited Financial Results for the quarter ended 30/06/2022

**NIVI TRADING LIMITED** 

Regd.Office:c/o United Phosphorus Ltd.,Readymoney Terrace, 4th floor, 167,Dr.A.B.Road,Worli Naka, Mumbai-400018 Tel. No. 61233500 Fax No. 264875232.Emil dr. nixi.nvestrs@uniphos.com,Website:www.nivionline.com
CIN: L99999MH1985PLC036391


PARTICULARS	Quarter ended 30/06/2022 Unaudited	Quarter ended 31/03/2022 Audited	Quarter ended 30/06/2021 Unaudited	Year ended 31/03/2022 Audited
Total income from operations  Net Profit/(loss) for the period before	3.92	1.87	1.19	5.46
tax and exceptional items	0.02	(0.07)	(2.47)	(0.75)
Net Profit/(loss) for the period after tax Total Comprehensive Income for the period (Comprising profit for the period (after tax) and Other	0.02	0.03	(2.47)	(0.64)
Comprehensive income (after tax)}	(1.19)	0.93	2.98	5.05
Equity Share Capital Other Equity Earnings Per Share (before Total	124.56	124.56	124.56	124.56 44.68
Comprehensive Income) (of Rs 10/- each): Basic and diluted (Rs. Per share) (not annualised)	0.00	0.00	(0.20)	(0.05)

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Regulations, S2015. The Hill format of the Quarterly Financial Results are available on the website of the Company at www.nivionline.com and may also be accessed on the website of the Stock Exchange, i.e. BSE Limited (BSE) at www.bseindia.com, where the equity shares of the Company are listed.

The above unaudited financial results were reviewed by the Audit Committee and thereafter approved at the meetin of the Board of Directors held on 8th August, 2022

FOR NIVI TRADING LIMITED (Sandra R. Shroff) Managing Director DIN - 00189012 Place : Mumbai Date : 8th August,2022

વાકજ રોક શાખા રેસીડેન્ટ્સ ગાર્ડન ફલેટ, ઉસ્માનપુરા



આથી. (સ્થાવર મિલકત માટે) **બેંક ઓફ ઇન્ડિયા, વાડજ રોડ શાખા,**ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિકયોરિટાઈપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ તથા કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા નિયમ ૩ અંતર્ગત તા. ૦૫.૦૫.૨૦૨૨ ના રોજ <mark>ઉદ્યારકર્તા શ્રી ફીરોઝખાન મોઇનખાન પઠાણ</mark> ને માંગણા નોટીસ જારી કરીને નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસોની અંદર બાકી રકમ **રૂા**. ૩૦,૫૨,૪૪७.૪૨ (રૂા.ત્રીસ લાખ બાવન હજાર ચારસો સુકતાલીસ અને બેતાલીસ પૈસા

ુ ઉદ્યારકર્તાઓ/ જામીનદારો સદરહુ રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ઉદ્યારકર્તાઓ/ જામીનદારો તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ ની ક્લમ ૧૩(૪) અંતર્ગત નિયમ ૮ સાથે વંચાણે લેતાં આપેલી સત્તાની 3એ અદ્યોહસ્તાક્ષરીએ **તા. ૦૪.૦૮.૨૦૨૨** ના રોજ નીચે જણાવેલ મિલક્તનો કબજો લઇ લીધેલ છે.

ઉદ્યારકર્તાઓ/ જામીનદારો ને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલક્ત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદર**ે**ંદુ સ્થાચી મિલકત અંગે કરેલો કોઇપણ વ્યવહાર **બેંક ઓફ ઇન્ડિયા, વાડજ રોડ શા**ખાની રકમ**રૂા**. 30.૫૨.૪૪७.૪૨ વતા વ્યાજ બોજાને આધીન રહેશે.

"સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાનું મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે."

### स्थावर भिल्ङतनुं वर्णन

સ્થાવર મિલકત રો હાઉસ નં. સી/૧૬૬, જેનો પ્લોટ એરીયાનું ક્ષેત્રફળ ૩૯.૦૫ સ્કે.મીટર સાથે તેના ઉપર થયેલ બાંધકામ જેનં ક્ષેત્રફળ ૪૦.૦૦ સ્કે.ચાર્ડ એટલે કે 33.૪૪ સ્કે.મીટર અજીત રેસીડેન્સીમાં જે બીન ખેતીલાયક જમીન મોજે ગામ રેશત રેવન્થ સર્વે નં. 33૮/૧–૨–3 પૈકી પરંજ અ 33૮/૧–૨–૩, ટી.પી. સ્કીમ નં. ૧૦, ફાઈનલ પ્લોટ નં. ૮૩–એ, + ૮૩–બી/૩ + ૫/૨ પૈકી અજીત મીલ કંપાઉન્ડ ખાતે આવેલ મોજે રખીચાલ તાલુકો મણીનગર ખાતે સ્થિત અને આવેલ રજીરદ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ અને સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ– ૭(ઓઢવ) ખાતે આવેલ તમામ મિલકતની ભાગ અને પાર્સલની વેચાણ દસ્તાવેજ મુજબની ચતુરસીમા : ઉત્તરે : રો હાઉસ નં. સી–૧૬૫, દક્ષીણે :હાઉસ નં. સી–૧૬૭, પૂર્વે : સોસાચટી રોડ, પશ્ચિમે : સોસાયટીની કોમન દીવાલ Cersai Asset ID-200033825291& Security ID-400033881471

અધિકૃત અધિકારી, તારીખ : ૦૪.૦૮.૨૦૨૨

પુરા) ભરવા જણાવેલ હતુ.

(બેંક ઓફ ઈન્ડિયા, વાડજ રોડ)

## आरोज र्घन्डस्ट्री**স લિમિટે**ड CIN: L31908GJ2013PLC077306

CIN: L513908412013FL07/7508 રજિસ્ટર્ડ ઓફિસ : બી- કપ & કક, જવાહર રોડ નં.ઝ, ઉધ્યોગનગર, ઉધના, સુરત -૩૯૪૧૦, ગુજરાત E-Mail: info1@aaronindustries.net | Website:www.aaronindustries.net | Ph.: 0261-2278410 ૯મી વાર્ષિક સામાન્ય બેઠક, બુક ક્લોઝર અને ઇ-વોટિંગ માહિતી

ભ્ની વાર્ષિક સામાન્ય બેઠક, બુક ક્લોઝર અને ઇ-વોટિંગ માહિતી આથી નોટિસ આપવામાં આવે છે કે આરોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના સભ્યોની ૯મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) શનિવાર, ૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ૧૧,૦૦ વાગ્યે (IST) માત્ર વિડીયો કોન્ફરનિયો, "વીસી") અન્ય ઓડિયો-વિઝયુઆત મીન્સ ("ઓએબીએમ", ફાર ચેજીએમ ની નોટિસમાં દર્શાવ્યા મુજબ વ્યવસાયોનો વ્યવહાર કરવા માટે યોજાશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોસ્ટ મંત્રાલય ('MCA') દ્વારા ૮મી એપ્રિલ, ૨૦૨૦, ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, ૫મમી, ૨૦૨૦, ૧૩મી જન્યુ આદી, ૨૦૨૧, ૧૪મી ડિસેમ્બન્ડ, ૨૦૨૧ અને ૧૫ની મે, ૧૦૨૧, ૧૫મી, ૧૦૨૦, ૧૩મી જન્યુ આદી, ૨૦૨૧, ૧૪મી ડિસેમ્બન્ડ, ૨૦૨૧ અને ૧૫ની મે, ૧૦૨૧, ૧૫મી, ૧૦૨૦, ૧૫મી જન્યુ અને ૧૩મી મે, ૨૦૨૦, ૧૫મી જન્યુ આદી, ૨૦૨૧ અને ૧૩મી મે, ૨૦૨૨, લામુહિક રીતે 'EBB પરિપત્ર'), ના રોજ જરી કરાયેલ સામાન્ય પરિપત્રો અનુસાર, કંપની સોમવાર, ૮મી ઓગેસ્ટ, ૨૦૨૨ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૧-૧૨ માટેના વાર્ષિક અહેવાલ સાથે હમી એજીએમ ની નીટિસ ફક્ત ઇલેક્ટ્રીનેક મોડ દ્વારા, તે સલ્ચોને મોકલી છે જેમના ઈ-મેલ સન્યમામાં કંપની/દર્શસ્ટાર અને ૨)ન્સફર એજ-(ડિપોઝિટરેડ) સાથે નોંધાયેલા છે. વાર્ષિક અહેવાલ સાથે એજીએમ ની સુચના ની ભીતિક નકલો મોકલવાની જરિયાત એમસીએ પરિપત્રો અને સંબીપરિપત્રો દ્વારા લિતરિત કરવામાં આવીછે. નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૨ માટે કંપની નો વાર્ષિક અહેવાલ સાથે, એજીએમ ની સુચના કંપની ની વેબસાઇટ www.nseindia.com પર પણ ઉપલબ્લ કરાવામાં આવશે. બુક કલોઝર નોટિસ અને ડિવિડન્ક

<u>બુક ક્લોઝર નોટિસ અને ડિવિડન્ડ</u>

ગું ક અવાન્ત્રષ્ટ નાહિલ અને 15143 જે કંપની ના કાયદા, ૧૦૧૩ ની કલમ ૯નની જોગવાઈઓ અનુસાર લાગુ કરાયેલા નિયમો અને સેબીનું ૪૨ નિયમન (લિસ્ટિંગ ઓબ્લિંગેશન્સ અને કિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૧૦૧૫, અનુસાર સભ્યોનું રિજસ્ટર અને શેર ટ્રાન્સફર બુકની કાર્યવાદી નાણાકીય વર્ષ ૧૦૧૧-૨૨ના ફાઇનલ ડિવિડન્ડ અને એજીએમ હેતુ માટે રવિવાર, ૪મી સપ્ટેમ્બર, ૨૦૧૨ થી શનિવાર, ૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ (બં- દિવસો સહિત) સુધી બંધ રહેશે. ડિવિડન્ડ ૧૦.૦/૦ સંપૂર્ણ પેઇડ-અપ ઇસ્તિટી શેર દીઠ, જો એજીએમ માં સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવે તો તે તમામ લાભાર્થી માલિકોને સ્ત્રોત પર કર (TDS') કપાત ને આધીન ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખવામાં આવેલા શેરના સંદર્ભ માં ડિપોઝિટરીઝ દ્વારા અને મુજબ યુકવવા માં આવશે.

મુજબ ચુકવવા માં આવશે. <u>રિમોટ ઇ-વોટિંગ અને એજીએમ દરમિયાન ઈ-વોટિંગ</u> કંપની ની ધારા ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની જોગવાય તથા કંપની (મેનેજમેન્ટ અને એડિમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ તથા સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર રિક્વાયર મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમ ૪૪ ના અન્વયે અને ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ઢારા જો કરવામાં આવેલી સામાન્ય સભાઓ (જોસએસન), મુજબ, કંપની તેના સભ્યોને, એજીએમમાં વ્યવફારો કરવા માટે ના વ્યવસાયો માટે એજીએમ પહેલા/દરમિયાન રિમોટ ઇન્વોટિંગ ની સુવિધા પૂરી પાંડ છે અને આ દેતુ માટે, કંપની એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સુવિધા માટે સીડીએસએલ ની નિમણક કરી છે.

વાં કહ્યું વાં કહ્યું વાં તાં કે પ્રાપ્ત કર્યા કર્યા હતું છે. સ્થિતિક ઇ-વોટિંગ માટે ની વિગત વાર સૂચના ઓ એજીએમ બોલાવતી નોટિસ માં આપવામાં આવી છે. સભ્યોએ નીચેની બાબતો ની નોંધ લેવા વિનંતી છે:

૧.રિમોટ ઇ-વોટિંગ સુવિધા નીચેના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે: રિમોટ ઈ વોટિંગ નો પ્રારંભ વિધવાર, ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે શરુ થશે

રિમોટ ઈ વોટિંગ પૂર્ણ થશે 🔝 શુક્રવાર, ૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સાંજે પ:00 કલાકે પૂર્ણ થશે

ારિમાટ ઇ વાટિંગ પૂર્ણ થશે શું કુલાર, દેના સારા-અંદર, રે0રર ના રાજ સાજ પ:00 કલાક પૂર્ણ થશે ! સીડીએસએલ દ્વારા (રેમોટ ઇ-વોર્ટિંગ મોડ્યુલને ત્યારબાદ મતદાન માટે અક્ષમ કરવામાં આવશે અને સભ્યોને તારીખ અને સમય ની બહાર ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ર. ઇ-વોર્ટિંગના હેતુ માટે કટ-ઓફ તારીખ શનિવાર, ગ્રેમી સપ્ટેમ્બર, ૨૦૨૨ છે. સભ્યો, જેમના નામ શનિવાર, ગ્રેમી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સભ્યોના રિજસ્ટરમાં દેખાઈ રહ્યા છે તેઓ ઈ-વોર્ટિંગ દ્વારા મત આપવા માટે હકદાર છે, અને એજીએમ પહેલાં રિમોટ ઇ-વોર્ટિંગ દ્વારા હરૂવલ પર પોતાનો મત આપવા અને ભાગ લેવા માટે હકદાર છે, અને એજીએમ પહેલાં રિમોટ ઇ-વોર્ટિંગ હોરા હરૂવલ પર પોતાનો મત આપવા અને ભાગ લેવા માટે હકદાર છે, અને એજીએમ પહેલાં રિમોટ ઇ-વોર્ટિંગ હોરા હરૂવલ પર પોતાનો મત આપવા અને તેએ એએ કદમીચાન ઇ-વોર્ટિંગ સિસ્ટમ દ્વારા મત આપવા માટે લાચક રહેશે. ૪. કોઈ પણ વ્યક્તિ, જે કંપનીના શેર હસ્તગત કરે છે અને નોટિસ મોકલ્યા પછી કંપનીના સભ્ય બને છે અને કટ ઓફ તારીખ એટલે કે શનિવાર, ગ્રેમી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શેર ઘરાલે છે, તે રિમોટ ઈ-વોર્ટિંગ સાઢે લીઝોન હોરા આપવામાં આવેલ ટોલફી નંબર ૧૮૦૦ રૂપ પ ૩ પર સંપર્ક કરી મેળવી શકે છે, જે વ્યક્તિ કર-ઓફ ડેટ પર સલ્ય નથી તેથો માત્ર માહિની ના હેતુ માટે એજીએમ મતદાન કર્યું છે તેઓ વીસી/ઓએએએમ મારફતે એજીએમ માં ભાગ લેવા/જોડાવા માટે હકદાર છે પરંતુ બેઠક દરમિયાન તેમનો મત આપવા માટે હકદાર નથી.

એજીએમ અને ઈ-વોટિંગ માં કાજરી આપવા અંગે કોર્<sup>5</sup> પ્રશ્નો અથવા સમસ્યા જારી કરવામાં આવે તો, તમે મદદ વિભાગ કેઠળ www.evotingindia.com પર ઉપલબ્ધ વારવાર પૂછાતા પ્રશ્નો (ફએક્યૂ) અને ઈ-વોટિંગ્ વિભાગ કેઠળ www.evotingindia.com પર ઉપલબ્ધ વારેવાર પુછાતા પ્રશ્નો (ફએક્યૂ) અને ઈ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકી છો અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈ-મેઇલ લખી શકો છો અથવા૧૮૦૦ ૨૨ પપ ૩૩ પર સંપર્ક કરો.

आरोन ઇन्डस्ट्रीઝ લિમીટેડ માટે સહી/-

તારીખઃ ૦૮-૦૮-૨૦૨૨

નીતીનકુમાર માણીયા કંપની સેક્રેટરી એન્ડ કમ્પ્લાયન્સ ઓફીસર स्थण : सुरत